

Disengagement at Patrolling Point 17A

August 06, 2021

પેટ્રોલિંગ પોઈન્ટ 17A પરથી પાછા ખસ્યા

ઓગસ્ટ 06, 2021

1. આ સમાહે અગાઉ જણાવ્યું તે પ્રમાણે ભારત અને ચીનના કોર્સ કમાન્ડરો વચ્ચે 31 જુલાઈ 2021ના રોજ પૂર્વ લદાખમાં યુશુલ મોલ્ડો મિટિંગ પોઈન્ટ પર વાતચીતનો બારમો રાઉન્ડ યોજાયો હતો.
2. બંને પક્ષોએ ભારત-ચીન સરહદી વિસ્તારના વેસ્ટર્ન સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પાછા ખસી જવાને લગતા બાકીના મુદ્દાઓના ઉકેલ માટે વિચારોનું નિખાલસ અને ઉંડાણપૂર્વક આદાનપ્રદાન કર્યું હતું. આ બેઠકના પરિણામ તરીકે બંને પક્ષો ગોગરા ક્ષેત્રમાં પાછળ ખસવા સહમત થયા હતા. ગયા વર્ષના મે મહિનાથી આ વિસ્તારમાં બંને પક્ષના સૈનિકો એક બીજાની સામે ગોઠવાયા છે.
3. સહમતિ મુજબ બંને પક્ષોએ આ વિસ્તારમાં તબક્કાવાર, સંકલિત અને વેરિફાઇડ રીતે ફોરવર્ડ ડિપ્લોયમેન્ટ અટકાવી દીધું છે. પાછળ ખસવાની આ પ્રક્રિયા 4 અને 5 ઓગસ્ટ 2021ના રોજ કરવામાં આવી હતી. બંને પક્ષના સૈનિકો હવે પોતપોતાના કાયમી બેઝ પર છે.
4. તમામ કામચલાઉ સ્ટ્રક્ચર અને બીજું સંલગ્ન માળખું, જે આ વિસ્તારમાં બંને પક્ષ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું તે નષ્ટ કરવામાં આવ્યું છે અને તેની પરસ્પર ચકાસણી થઈ છે. બંને પક્ષોએ આ વિસ્તારમાં જમીનનું સ્વરૂપ પહેલાં જેવું જ કરી દીધું છે જે વિવાદ અગાઉના સમયમાં હતું.
5. આ સહમતિ એ બાબત સુનિશ્ચિત કરે છે કે આ વિસ્તારમાં એલએસીનું યુસ્ત રીતે પાલન થશે અને બંને પક્ષો દ્વારા તેનું સન્માન કરવામાં આવશે, તથા યથાવત સ્થિતિમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે.
6. આ સાથે આ વિવાદની વધુ એક સંવેદનશીલ બાબતનો ઉકેલ આવ્યો છે. બંને પક્ષોએ વાતચીત આગળ વધારવા અને વેસ્ટર્ન સેક્ટરમાં એલએસી પર બાકીના મુદ્દાઓના હલ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
7. ભારતીય સેના અને આઇટીબીપી રાષ્ટ્રના સાર્વભૌમત્વના રક્ષણ માટે તથા વેસ્ટર્ન સેક્ટરમાં એલએસી પર શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.

નવી દિલ્હી

ઓગસ્ટ 06, 2021

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.